

August 28, 2021

To,
Department of Corporate Services
BSE Limited
25th Floor, P. J. Tower,
Dalal Street,
Fort, Mumbai - 400 001

Dear Sir/Madam,

Sub: PUBLICATION OF NOTICE FOR TRANSFER OF UNCLAIMED DIVIDENDS AND EQUITY SHARES OF THE COMPANY TO INVESTOR EDUCATION AND PROTECTION FUND

Pursuant to the provisions of Section 124 of Companies Act, 2013 read with Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 as amended from time to time ("IEPF Rules'), we have published a notice in the newspapers as required under the Act. A copy each of the said notice and a letter circulated to the concerned shareholders is attached for your information and records.

Please take the same on your record.

Thanking You,

Yours faithfully,

For Gujarat Natural Resources Limited

Sheetal Pandya Company Secretary



Relaxations sought for Ganpati immersions

called the Ganpad capital too.
While there has been some respite with the state government relaxing current ill midnight during the festival, other aspects like installation and immersion processions are still being debated upon.
The issue of the size of pandals became clear only on Wednesday when minister Yogesh Patel discussed in the cabinet meeting. Patel said that after his representation it

had been decided that the pandlas should not be bigger than 300 square feet. Patel said that he had discussed this too and arrangements will be made. The organisers have also sought that some concessions should be given for immersion processions and Dis should be allowed. Many organisers have been arguing that programmes of political parties were going on with large crowds and Dis, but Ganpati processions were not being allowed. Another

Vedanta Foundation announced the opening of 100 training centers



Ahmedabad, The newly known as Rojgar centers, will be in addition to its current 170 be in addition to its current 1/V centers functional across India. 37 such centers were opened this month. Through its skill model, Vedanta Foundation intends to skill students and unemployed students and unemployed youth from the economically weaker sections and link them to job opportunities. With this intent, the Foundation is working closely with the industry to map possible employment opportunities in each of the Rojgaar centers. Some of the companies that Some of the companies that have recruited candidates from the Rojgar centers

training centers
include State Bank of India, Axis Bank, Paytm, Reliance, Godrei, Flipkart, Amazon, Genpact, LiC, among others.
"We launched our Vedanta Rojgar initiative in the year 2020 when the country was or the COVID virus, Millions of youths had lost their jobs. The state of migrant workers working in metropolises was particularly dismal. That's when we laid the foundation of our pilot project Vedanta Rojgar,' said Suman Didwania, Trustee, Vedanta Foundation. Furthermore, the Foundation has also started partnering with a few Sector Skill Councils (SSC) set up under Skill India 'Kaushal Bharat' programme of Government of India to ensure better onnect with the industry demands for better livelihood opportunities for the trainees. These include the Automotive SSC, Tourism and Hospitality SSC, Tourism and Hespitality SSC, Tourism and Hespitali Tourism and Hospitality SSC, Electronic SSC, and Telecom SSC. (13-9)

Amazon Prime Launches the Trailer of Upcoming Series Mumbai Diaries 26/11



Ahmedabad, Amazon Prime Video, today, unveiled the trailer of its upcoming fictional medical drama set against the backdrop of 26/11 attacks - Amazon Original Series Mumbai Diaries 26/11. Ahmedabad, Amazon Series Mumbai Diaries 26/11.
The trailer launch event held at the iconic Gateway of India paid homage to the bravery, commitment and selfless sacrifice of Mumbai's frontline warriors like doctors and police force. Titled Sahas ko Salam, the event celebrated the the event celebrated the invaluable sacrifices of Mumbai's frontline heroes in the presence of Honourable Minister of Tourism, Environment & Protocol, Government of Maharashtra, Shri Aaditya Thackeray, Aparna Purohit, Head of India Originals. Amazon Prime Aparna Purohit, Head of India Originals, Amazon Prime Video, India, director and creator Nikkhil Advani along director and creator Nikkhil Advani along

with the producers and the cast of the series.

Mumbai Diaries 26/11 is a fictional edge-of-the-seat medical drama that is set against the terrifying, unforgettable night that, on one hand ravaged the city, but on the other hand also united its people and strengthened. its people and strengthened their resolve to stand resolutely against any adversity. The series is an account of events that unfold in a government hospital and explore the challenges faced by the medical staff at the hospital as well as other first hospital as well as other first responders across the city of Mumbai while dealing with a monumental crisis. Mumbai Diaries 26/11 will launch on

Prestige Masters Series is back to celebrate and reward

Ahmedabad, Riding high on the success ofits inception in 2015, the single most anticipated annual tournament anticipated annual tournament for amateur golfers, the 'Prestige Masters Series', has returned with its 7th Edition at the Prestige Golfshire Club in Bengaluru. Despite the pandemic, this year's tournament allured 120 en thu siastic golfers' participation from countres across the globe like India, Spain, South Africa, UK and Great the Deput Two of the

With the Round Two of the due on Saturday 21st August 2021, the First Round of the 2021, the First Round of the highly anticipated industry event which concluded on 24th July 2021 declared Himangshu Baruah with 42 points; Suresh HA with 41 Points; and Ashok Chokalingam with 39 points as

Saturday, 20thNovember 2021.The overall year end price for the winner includes a business class trip for two a business class trip for two to Greece with a stay at the multi award winning, Troon Golf managed, Costa Navarino Westin Resort on the west coast of Greece along and a 2021 Masters Golf Bag from 2021 Masters Golf Bag from the Augusta Masters Collection. Commenting on the event, Declan McCollam, General Manager of the Prestige Golfshire Club said, "We are humbledby the active participation that our annual property, Prestige Masters Series has witnessed this year, especially in cognizance of the current scenario. In the absence of a full qualifying tournament for the last two years, golfers are zealous to compete in this esteemed event. We are honoured to cleibrate and reward Chokalingam with 39 points as the top three qualifiers.Participating golfers will compete for 15 spots, at the thrilling/Masters Series Finale scheduled to be held on the prestige Masters Series family."(19-10)

Cryptocurrency Fantasy Gaming Platform aspect that has raised eyebrows is that the artificial ponds for immersions was still rain

Ahmedabad, Last year, India emerged as the World's second largest Cryptocurrency market by adoption. With the aim to revolutionize the whole experience, Rainmaker theWorld's first Cryptocurrency fantasy gaming platformwas launched today, to offer India'scrypto

nad discussed this too and arrangements will be made. Vadodara Municipal Corporation mayor Keyur Rokadia said that the civic body would be sticking to guidelines. Indian Pharmaceutical Company conducts Clinical Analysis

Ahmedabad, According to Rohit Parate, and Dr. Abhay recent stats, 2.77 crores of COVID-19 sufferers were findings on a new COVID-19 recovered from 2.88 crore clinical trial in the Medica cases in India. All corporate Journal of Advances in Clinical offices and businesses want to operate outdoors but worry much about the Post Covid difficulties and resolutions. While companies were involved in launching products and promoting claims that it fights the Coronavirus, repeatchers ran clinical tests. researchers ran clinical tests to confirm how consuming immunity supplements resolve mild to moderate COVID-19 patients. Dr. Neha Shah, Dr.

ponds for immersions was still not ready. Patel said that he had discussed this too and

Toxicology. A randomized, open-label, 2 Arm, prospective study was investigated for the safety and efficacy of the health supplements. Fortunately, ImmunoSEB + ProbioSEB CSC3 as supplemental therapy was supplemental therapy was Fortunately, ImmunoSEB + ProbioSEB CSC3 as supplemental therapy was confirmed to be beneficial in mild to moderate COVID-19 patients and showed overall clinical improvement in WHO 7-point ordinal scale. (1-7)

Hitachi eyes aggressive expansion plans in Gujarat

Ahmedabad, Johnson Controls-Hitachi Air Conditioning India, manufacturer of India's one of the largest selling air conditioner brand 'Hitachi Cooling and Heating' today announced its aggressive expansion plans to capture the expression plans to capture the expression plans to capture the expression residential and expansion pians to capture the promising residential and commercial air conditioning market in Gujarat. In its endeavour to offer a superior product experience to premium customers, architects, consultants and builders, looking for innovative air conditioning solutions for Dulliders, looking for innovative air conditioning solutions for their residential and commercial spaces, Hitachi has introduced its first of its kind 'Hitachi Brand Shop' concept. Being an 'Air Expert, Hitachi has plans to set new

benchmarks for the rising Light commercial air conditioning segment by taking the Brand Shops to key markets across the country. The Company is also bullish on the retail footprint in the region and is aggressively looking to expand its existing retail tout points from 900 to over 1500 in next 2-3 years. The company is also doubling its channel partner strength in Gujarat by taking the current 120 decleres count too ver 250 in the next three years. The company is also on a massive localization drive and endeavours to promote and push "Made in India" ACs. The company has also on a massive localization drive and endeavours to promote and push "Made in India" ACs. The company has also recently announced to reduce its component imports to reduce its component imports to reduce its component imports to reduce the condition of the next three years. (19-10)

EdelGive announces the launch of the GROW Philanthropic Fund

Ahmedabad, The past year has brought with it the COVID- action to mobilise good will. 19 pandemic and extreme appress and resources to adversity, impacting several lives and livelihood sacross the country. Among st

efforts while barely managing to survive or sustain themselves. As a result, today, many of these organisations are grappling with depleted reserves of funds, organisational fatigue and the risk of forced closure, as community needs and vulnerabilities compound and deepen. During this challenging time, EdelGive continues to place its hope in

lives and livelinood sacross the only timely, but also holistic. Country, Among st the most severely affected, we shall be a severely affected, we have a severely as the most severely as the most severely as a severely and the severely as a severely and the severely as a severely and the severely as a severely as a severely as a severely as a severely and the severely as a severely as a severely as a severely as a severely and the severely as a s issues are effectively solved."-Vidya Shah, Executive Chairperson, EdelGive Foundation.(19-10)

Max Ventilator goes global with its newly formed partnership



Ahmedabad, In an effort to go global, Max ventilator, India's leading ventilator maker, has worked out a technology collaboration agreement with Amptron Medical, a US-based respiratory technology company. This strategic partnership move signals India's top ventilator partnership move signals India's top ventilator breathing machines and other medical devices according to international standards and certifications. From now onwards, Max will make products based on international exchincia and quality standards and therefore seek international certifications. Furthermore, with Amptron's R&D infrastructure and the team being entirely Ahmedahad, In an effort to

based in the US, their products will have US/international approvals.
"Although unfortunate, while Covid was the much-needed trigger for the Indian ventilator makers to ramp up

ventilator makers to ramp up capacities in terms of quantity, the pandemic has also given a stimulus to the need and imperative for quality of these lifesaving breathing devices. Until now, Indian products were limited to having Indian certifications. This also cuttailed access the curtailed access to international markets for their products. However, with this joint venture with Amptron, Max intends to go truly global in its manufacturing outlook and approach to expand our approach to expand our presence in developed markets. With Amptron's cutting edge technology expertise in medical devices space, we are confident that this collaboration will give a new impetus to Max's global vision and ambition while also adding tenenth to India's global vision and ambition willing also adding strength to India's quest for becoming a world-class manufacturer of ventilators and other medical devices, said Mr Ashok Patel, the founder and brain behind Max Ventilator. (19-10)

Rainmaker presents the World'sfirst-ever

maker • enthusiasts and crypto curious a whole new and unique trading experience.

a whole new and unique trading experience. Shedding more light on the thought behind this joneering idea, Harsh Himmatsingka, Founder& CEO, Rainmaker said, "While India's love for cryptocurrency trading has outdone that of even the US and China, the knowledge around how to maximize one's investment in crypto trading is sill limited. With Rainmaker, it is not only the crypto literate that we hope to attract, but also those who are unsure but crypto curious; that we hope to arm with the knowledge needed to confidently become an actual crypto trader." Rainmaker is based on the core vision of democratising knowledge for individuals interested in learning the nuances of this investment avenue in a fun way.It offers a near-real experience by gamifying trades and inviting players to learn analytical skillsin crypto portfolio management. The platform also offers a similar experience in stock trading, replicating that of actual Stock Exchanges in stock trading, replicating that of actual Stock Exchanges in India. Rainmaker is now available on iTunes and Google Play Store. (19-10)

Facebook Powers Growth Of Small Businesses In Guiarat Through Numerous Initiatives

Ahmedabad, 26th August 2021: As part of its recently announced 'Small Business Loans Initiative', Facebook today said that the program will be open to its small business advertisers across 30 cities and towns of Gujarat. This program aims to help small and medium businesses small and medium businesses small and medium businesses (SMBs) that advertise on Facebook to get quick access to credit through independent lending partners. There are several

interesting trends emerging from Gujarat on how small businesses are using digital to grow. Three Gujarat-based businesses, The Indian Ethnic businesses, The Indian Ethnic Co., MyBageecha, and SourceItRight, among many others have seen exponential others have seen exponential growth by increasing the use of social media and digital. Digital and the Facebook apps have helped many SMBs from Gujarat to tap into markets across India, as well as internationally, multiplying their economic opportunities.

Several SMBs from the state have also used Facebook, Instagram, and WhatsApp to go direct-to-consumer, leading to explosive growth for their businesses.

Gujarat is home to 33.16 lakh people. There is a strong thust on growth of women arough the women.

lakh people. There is a strong thust on growth of women MSMEs and currently there are 8.2 lakh women led MSMEs in Gujarat.
Speaking about Facebook's commitment to the empowerment of the small and medium business ecosystem in Gujarat, Archana Vohra, Director - Small and Medium Businesse at Facebook India said, "Gujarat's SMB community has demonstrated incredible "Gujarat's SMB community has demonstrated incredible resilience even during the pandemic. There are numerous examples of small businesses from the state that are consistently growing by using digital and social media. Facebook apps have enabled anny of these businesses to pandemic. There are numerous examples of small businesses from the state that are consistently growing by using digital and social media. Facebook apps have enabled many of these businesses to the social media. Facebook apps have enabled many of these businesses to the social media.



go direct-to-consumer,

Couple booked for selling rented cars A couple living in Growa was arrested on Wednesday for hiring 17 different areas of Vadodara on the couple, the couple did not the couple, the couple did not the couple, the couple did not the couple.

cars on rent and then selling them off without informing the owners. Police said that Raj med alia

Sheikh and his wife Nimisha

IIM Ahmedabad and Bank of America partner to set up a Centre for Digital Transformation



CIN- L27100G11991PLC016158
Regd. Office: 3rd Floor, A Wing, Gopal Palace, Opp. Ocean
Park, Nr. Nehru Nagar, Satellite Road, Ahmedabad - 380015
Phone No. : 079-40029806, E-mail ID: info@gnrl.in
Website: www.gnrl.in
NOTICE

TRANSFER OF UNCLAIMED DIVIDENDS AND EQUITY SHARES OF THE COMPANY TO INVESTOR EDUCATION AND PROTECTION FUNI

NOTICE is hereby given that pursuant to the provisions of Section 124(6 of Companies Act, 2013 read with Investor Education and Protice Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2014 as amended from time to time ("EIPF Rules"), nordified by the Ministry Corporate Affairs all such share(s)in respect of which dividend(s) had not been paid or claimed by the shareholders for seven consecutive.

Ahmedabad, Indian Institute of Management Ahmedabad (IIMA), thepremier global management institution, has partnered with Bank of partnered with Bank of America to launch a Centre for Digital Transformation (CDT). The Centre aspires to become a vibrant knowledge hub for academia, policymaking, and the private sector by facilitating cutting-edge research on digital transformation and innovation.

transformation and innovation.

The Centre for Digital Transformation was launched with an event which was attended by faculty members of IIMA, along with well-known leaders from industry society." (19-10)

Place: Ahmedabad Date: 25.08.2021

and academic institutions from India and abroad. Announcing the launch of the Centre, Professor Errol D'Souza, Director, IIMA, said, "Advancements in the information technology sector are growing rapidly and transforming the way we function. The pandemic has further revealed the value of further revealed the value of digital operating models and the need for industry, institutions, and nations to ramp up their adoption of technology. Therefore, it becomes imperative that we study the impact of this digital transformation on business, overroment individuales.

GUJARAT NATURAL RESOURCES LIMITED

the couple, the couple did not pay them the rent. When the car owners asked the two accused to return their cars, they said that they had sold them off. Shocked by the duo's action, the car owners approached police and an offence of cheating was registered at Gorwa police station. a monthly rent of Rs 20,000 to Rs 26,000. The duo had told the car owners that they have contacts in different companies in Vadodara and they can sub-let the cars. Since many of the car owners were using their vehicles as school vans, they decided to give their vehicles on rent.

Amazon Pay introduces voice notification feature Business app

Ahmedabad, Amazon Pay today announced the launch of voice notifications for the vamazon Pay for Business across India can enjoy a hassle-free experience eradicating beak business hourswaiting peak business hourswaiting merchants to keep tabs to nay the validational minutesspent during peak business hourswaiting or morthants look up their phone for notifications, the Amazon Pay of Business app enables small merchants to manage their day to-daytransactions and distractions and continuation of received in the proposed programments and the programments and the programment programments and the program audio confirmation of received payments, thus enabling merchants to serve their customers instead of getting distracted by checking for

merchants to manage their day-to-daytransactions and simplify accepting digital payments. It is a multi-lingular payments it is a multi-lingular payments for merchants across the country. They can set up their preferred language in simple steps post registering themselves as a merchant. Speaking on the launch, Mahendra Nerurkar, CEO-Amazon Payrs India, said, "Amazon Payfs and consolidated view of payments received. (19-10)

SHRIRAM HOUSING FINANCE LIMITED

Reg. off.: Office No.123, Angappa Naicken Street,

SHRIR M THE STREET HOUSE HOLD STREET HOUSE HOLD STREET HOUSE HOLD STREET HOUSE HOLD STREET HOLD STREET HOLD STREET HOLD STREET HOLD STREET HOUSE HOLD STREET HO SYMBOLIC POSSESSION NOTICE

Whereas, The undersigned being the authorised officer of Shriram Housin Finance Limited (SHFL) under the provisions of the Securifisation an Reconstruction of Financial Assets and Enforcement of Searchy Interest AC 2002 (Said Act) and in exercise of powers conferred under Section 13(12) of the said Act and with Rule 3 of the Security Interest (Enforcement) Fulse, 200, (Said Mules) issued demand notices to the Borrowers details of which ar mentioned in the table below to repsy the amount mentioned in the said demand.

notices.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken \$YMBOLIC POSSESSION of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with rule 8 of the said Rules on 24/08/2021.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the charge of Shriam Housing Finance Ltd. for an amount as mentioned herein below with interest thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

and address just Virchandbhai J. Jingku Virchandbhai J. Ros 9.7734/- All that piece and parcel of the land and building bearing. Plot No.1186 dearning Plot No.1186 dearning Plot No.1186 dearning about 44.59 as on and part of the land and building a son and part of the land and building a son and part of the land and building a son and part of the land and building a son and part of the land and building a son and bearing Plot No.1186 dearning Blotck No.1476 dearning Blotck No.147	ie Act, iii respect or tiirii	e avaliable, to reueerii tri	ie secureu assets.
Sarojben Dipak Sarojb	Borrower Name and address		
notice. North : Plot No.1185	ilipak Virchandbhai el, Sarojben Dipak el ress :- no.1186, Nagar Society, ir Ambika Society, ir Ambika Society, doli-Kharvasa Road, doli-Kharvasa Road, doli,	(Rupees Eight Lakh Ninety Seven Thousand Seven Hundred Thirty Four Only) as on 12/05/2021 under reference of Loan Account No.SLPHSRAT0000 024 with further interest at the contractual rate, within 60 days from the date of receipt of the said	the land and building bearing Plot No.1186 admeasuring about 44.58 Sq.Mrs. Situated on Hand bearing Block No.147 it's Revenue Survey No.32 T.EScheme No.56 (Dindol-Godadara) EPNo.122/D. ol Ind oli Ta.Choryasi, District: Surat. Boundaries of the Property Cast. COP.
			South : Plot No.1187

as amended from time to time ("IEPF Rules"), notified by the Ministry of Corporate Affairs all such sharing(s) respect of which dividend(s) has compared the property of the compared the property of the compared to the transferred by the Company in Favor of the Investor Education and Protection Fund (IEPF) authority. Pursuant to the said-rules, the Shareholders who had not claimed the widen(s) for Seven consecutive years starting from the financial year 2013-14 and whose shares were liable to be transferred to IEPF, are shared to IEPF, are shared to IEPF, and the shareholders with the shareholders are requested on the website of the Company at www. gardin. The Company has communicated to the concerned shareholders individually who are yet to encash their dividend warrants in respect of financial year 2013-14 and onwards. The said shareholders are requested in the letter communicated.

The Shareholders are requested to note that in case the Company Registrar and Transfer Agent does not receive any communication from the concerned Shareholders by 15th November, 2012, the Company shall, with a view to adhering with the requirements of the Rules, Transfer the concerned procedure prescribed in the Rules, without giving any further notice to the Shareholders and no liability shall lie against the Company in respect of equity shares so transferrede.

The Shareholders may claim the amount of dividend and shares the same shall be appropriated to the shareholder of the IEPF authority, by ankaing an application to IEPF authority of the IEPF authority to Xianwa serious and available on the velocities of the IEPF authority by the America and Transfer Agent Pure Sharejustry (India) Private Limited (Xia Ms. Beepal Dhuri) Unit no. 3 Ms Shakail ind. Est., & Borchamarg, Land Transfer Agent Pure Sharejustry (India) Private Limited (Xia Ms. Beepal Dhuri) Unit no. 3 Ms Shakail ind. Est., & Borchamarg, Land Transfer Agent Pure Sharejustry (India) Private Limited For, Gujarat Natural Resources Limited For, Gujarat Natural Resources Li For, Gujarat Natural Resources Limited

DIN: 02467830

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે સોમનાથ સ્ટેશન પર ચાલી રહેલા વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું



rનરલ મેનેજર શ્રી આલોક કંસ**લે** ।।वनश्च हिविजनना ओसनाध ત્યાવયગરાડાવઝવવા સાવવાદ સ્ટેશનની મુલાકાત લીધી હતી જનરલેનેજર શ્રી કંસલે સ્ટેશન પ ઉપલબ્ધ પેસેન્જર સવિધાઓનું ઇપલબ્ધ વસાવ્યક સુવિધાઓ પુ આંકલન કર્યું હતું. તેમણે સોમનાથ સ્ટેશન ખાતે પ્લેટકોર્મ પર ખાનપાન સ્ટોલ, પેસેન્જર વેઇટિંગ રૂમ, વોટર કુલર, વેઇટિંગ રૂમ, દિલ્યાંગ ટ્રેલર, વેઇટિંગ રૂમપીવાના પાણીની સુવિધા, સ્ટેશન પર સ્વચ્છતા, કોચ ઇન્ડિકેટર. બુકિંગ ઓફિસ, ડિસ્પ્લે બોર્ડ અને કેટરિંગ સુવિધા, સ્ટેશન પર ઉપલબ્ધ થનારી વિવિધ સુવિધાઓ, કોચ ઇન્ડિકેટર બોર્ડ વગેરેનું પણ નિરીક્ષણ કર્યું. જનરલ મનેજરે રેલવે વિકાસ નિગમ લિમિટેડ (આરવીએનએલ) સાથે ડિવિઝન્ પર ગાલી રહેલા વિકાસ કામોના ચાલા ૨૯લા ૧૫કાસ કાયાયા સંદર્ભમાં બેઠક કરી, સોમનાથ સ્ટેશન પર જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી અને જલ્દી (દેલ લાવવાની ખાતી હાજર તમામ સામાન્ય પ્રતિનિધિઓને કોરોના રસીના બંને रोज लेवानो आग्रह स्थाँ हतो વાર્વાલાય દરમ્યાન તેમણે તે ગૌને અ પણ જણાવ્યું કે જીવ છે તો વિશ્વ છે તમે જીવ આપવાની વત ન કરો અ कावन आध्योल है अने आपनी અપુય વિલયાલ છે એવે આવેલ સમસ્યાઓને જલદીથી દૂર કરવાના પ્રયાસો કરીશું. મુસાફરોને ઉપલબ્ધ પેસેન્જર સુવિધાઓના નિરીક્ષણ દરમિયાન તેમણે આ સુવિધાઓ વધારવા સંબંધિત અધિકારીઓને યોગ્ય સૂચનાઓ પણ આપી હતી.

અંજારમાં લુંટમાં લેવાયેલ ગાડી અને બાઈક ચોરીના હોવાનું ખુલ્ય

ભુજ, પૂર્વ કચ્છના અંજારમાં અલગ દિશામાં તપાસ કરી રહી સોમવારે સાંજે થયેલી દર લાખની છે. અંજાર શહેરના ખત્રી ચોક પાસે તા ૧૫૧ પાંજ ૧ વર્ષ ૧૫ માં ૧૫ સનસત્તાળજ આગાંડવા લૂટ નામલ પોલીસને આજે લૂંટમાં ગયેલી કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસે કારનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે અંજારમાં તપાસ હાય પરા છે. અજારમા સોમવારે રાત્રિના સમયે દર લાખ રૂપિયાની થયેલી આંગડિયા લૂંટમાં લૂંટ્યરુઓ જેમોટરસાયકલનો ઉપયોગ કર્યો હતો તે ચોરીનું હોવાનું જાણવા મળ્યું છે. લૂંટારુઓએ આ ચોરીનું મોટર સાયકલ પહેલા ભોગ બનનાર આંગડિયા પેઢીના સંચાલકની કાર સાથે અથડાવ્યું હતું અને ઝઘડો કર્યો હતો. આ સમયે જ આંગડિયા પેઢીના સંચાલકને કારની બહાર ખેંચી લૂંદારાઓ રોક્ડ રકમ સાથે કારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલે જણાવ્યું હતું કે, જે મોટરસાયકલનો ઉપયોગ હતું કે, જે મોટરસાયકલના ઉપવાન થયો છે તે મોટર સાયકલની અંજારના રામકૃષ્ણ મહાવીર નગરમાંથી બે દિવસ પહેલા ચોરી થઈ હતી. પોલીસ હાલ લંટારુઓને ઝડપવા અલગ

શાતલ આઇન્ક્રામ પાછળ ૧૨ નાદર રોડ પર આવેલી એન. આર. આંગડિયા પેઢીના સંચાલક ભાવિન ઠક્કર સોમવારે મોડી સાંજે ઓફીસ ઠક્કર સામવાર માડા સાજ આરાત વધાવી ઘરે જવા કારમાં નીકળ્યા હતા, તેજ સમયે એક ટુ વહીલર સ્કૂટર (એક્ટિવા) સામેથી આવીને કાર સાથે અથડાયું હતું. જે અંગેની બોલાચાલી દરમિયાન ભે અજાણ્યા ઈસમોએ આંગડિયા પેઢીના સંચાલક ભાવિન ઠક્કરને કારમાંથી બહાર કાઢીને હંકારી ગયા હતા. કારમાં રહેલી રૂ. હકારા ગયા હતા. કારમાં રહેલા ફ. ૧૨.૮૮ લાખની ચેકડ સાથે હૂટારુઓ કરાર થઇ જતાં સંગલકે બૂમાબૂમ કરી મૃકી હતી. પણ હૂટારુઓ હવામાં ઓગળી ગયા હતા. પોલીસે ચત્રિના સમયે જ જિલ્લામાં નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી. ત્યારે આજે સવારે લુંટમાં ગયેલી કાર ભચાઉના ચીરઈ ગામ પાસેના ધોરીમાર્ગના સર્વિસ રોડના માર્ગની બાજુમાંથી બિન વારસી હાલતમાં મળી આવી હતી.

હતો. મોટાભાગે રાજકોટના લોકો

હતો. મોટાભાગે રાજકાટના લોકો વતનમાં જઈને તહેવારની ઉજવાલી કરતા હોય છે રિવિવારે રાજકોટ શહેરની આસપાસના ગામ જેવા કે જેતપુર, ગોંડલ, વીરપુર, જુનાગઢ, રાપાટા, જલદલ, પોરબી સહિતના ગામમાં જવા માટે વહેલી સવારથી સાંજ સુધી મુસાકરોનો મસારો જેવા મળ્યો હતો 'વ એક્સ્ટબસ દો ઘાવો

મળ્યો હતો. ૧૩ એકસ્ટ બસ દોડાવાઈ

वती उक्षाअंधनना हिवसे शब्दशेट ગરપાલિકા દ્વારા સિટીબસ સેવા મહાનગરપાલકા દ્વારા સટાબસ સવા અને મ્ઇ્ઝ બસ સેવામાં મહિલાઓને ફ્રી મુસાકરી કરવાની ભેટ આપવામાં આવી હતી. જેમાં શહેરની ૨૨,૦૨૩ મહિલાઓએ બસમાં ફ્રી મુસાકરી કરી

લાકાનો ભાડ જાવા મળી હતા. જેમાં ન્યારી ડેમ, પ્રશુ-નપાર્ક, આજી ડેમ, રેસકોર્સ તેમજ મસ્ટિપ્લેક્સમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. નવી ફિલ્મ જોવા માટે લોકો પરિવાર સાથે આવીને

ફિલ્મની મજા માણી હતી. સાથે શહેરની મુખ્ય બજારોમાં પણ હવે સાતમ-આઠમની ખરીદીની પણ રંગત જામી છે. રવિવારે શહેરના

મુખ્યમાર્ગો ઉપર ટ્રાફિકના દશ્યો જોવા

મનપાએ આપેલ સેવાનો હતો. રક્ષાબંધન પર્વ નિમિત્તે શહેરના

પડતર પ્રશ્નોને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. પુંજ કમિશનનો રિપોર્ટ જનતા સમશ મુકવામાં આવે એવી પણ એસપીજીની માગ કરવામાં આવી છે. અમારી પાસે મત એ અમાર્ટ મુખ્ય હથિયાર છે, અમદાવાદ અનામત આંદોલન ચાલુ જ છે અને આ વખતે આંદોલન માટે કોઈ અન આ વેખતે આદાલન માટે કાઇ ચહેરો નહીં હોય. આંદોલન સમયે જે સાથીઓ હતા તેઓ જે રાજકીય પશ સાથે જોડાયેલા છે તેમને રાજકીય નેતા અને અનામત આંદોલનકારી તરીકે બોલાવીશું. નીતિન પટેલ મહેસાણાના છે, અમારા ધારાસભ્ય છે એટલે તેમને સ્થાનિક પ્રશ્નોને લઈને રજઆતો સ્થાપિક પ્રશ્રાપ લઇવે રહૂઆતા કરતા જ હોય છે. આંદોલન વેગ પકડે ત્યારે સામ, દામ, દંડ, ભેદથી અમારા લોકોને પાર્ટીમાં સમાવી લે કે પોતાની તરક લઈ લે. પણ અમે કે પોતાની તરફ લઈ લે, પણ અમે લડત ચાલુ રાખીશું. ભૂતકાળમાં થયેલી ભૂલો ન થાય એ બાબતને ધ્યાનમાં રાખીશું અને લડત ચાલુ રાખીશું .વર્ષ ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય એવા સરદાર પટેલ સેવા દળ સુપ દ્વારા

સરદાર પટેલ સેવા દળ સુપ હારા પાઢીદાર આંદેલનમાં મૂત્ય પાઢીદાર ભાઈઓને શ્રદાંજલિ આપવામાં આવશે. ર ર ઓગસ્ટના કરેજ આમાન ગુજરાતમાં શ્રદાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. એ અલ્લે કર્યું કર્યું કર્યા કર્યું કર્યા કરા કર્યા કર્ય

આજ પત્રકારપારપદ કરા જ્ણાપ્યુ હતું કે અમારા અનામત આંદોલનના અનામતના મુદા સરકારે પૂરા કર્યા નથી. ચૂંટણી સમયે જ સરકાર તરફથી નોંધ

સમયે જ સરકાર તરફથી નોંધ લેવાતી હોય છે, પશ્ચ ઝમારી રજૂઆત ચાલુ જ છે. મૂંટણીમાં માન એક જ અમારું હથિયાર છે, એટલે તત્ર વે જ રાજકીય પાર્ટી અમારે સમર્થન કે સહયોગ નહીં કરે તેમને મત આપવામાં બેલ્લ્લિક રરીશું. લાલજી પટેલે આગળ ઉમેર્યું હતું કે સરકાર સત્તાના ઉપયોગ કરીશે જ્યા જ પ્રયાગ કરતી હોય છે, પણ અમને પટેલામ આગો જ લાલજ પટેલ જ

પરિવામ મળશે જ. લાલજી પટેલે

મત એ અમારુ મુખ્ય ક્ષાયવાર છે, સંજ કીય છે. રાજકીય પ્રેશરમાં પણ નિવેદનો આવતાં હોય છે, બહુમતી આવે એ નક્કી કરતા હોય છે. સમાજમાં બૌહિક લોકો છે, એટલે પોતાની તરફ વળવા માટે પ્રયાસ થતા જ હોય છે. તેમણે વધુમાં કહ્યું, કેન્દ્ર સરકારે મ્ઝ બિલ પસાર કરી રાજ્ય સરકારને રજઆત કરીશં.

જે પાર્ટી પાટીદારોનું સમર્થન નહી

કરે તેનો બહિષ્કાર : લાલજી પટેલ

મંજૂરી આપી છે. "મ્ઝ પંચમાં અનામત લાભ માટે અગાઉ રજૂઆત કરી છે. સમાજના વડીલો અને બૉલિક લોકો સાથે મીટિંગ કરીને પાટીદાર સમાજને "મ્ઝમાં કાયદાકીય રીતે કઈ રીતે સમાવેશ કાયદાકાય રીત કઈ રાંત સમાવશ કરવો એની ચર્ચા કરીશું. સરકાર સત્તામાં હોય ત્યારે સામ-દામ દંડનો ઉપયોગ કરે છે. અમારી સામે થયેલા કેસો હજી પાછા નથી લેવાયા, જેને લઈ અમે તમામ કેસોની કાઇલ લઈ ગૃહમંત્રીને મળીશું અને કેસો પાછા ખેંચવા રજ્યના કરીશ

ચાંદખેડાની પરિણીતાની

સાસરિયાઓનો ત્રાસની ફરિયાદ અમદાવાદ, ચાંદખેડામાં રહેતા શીતલબેહન પ્રિયદર્શી(૪૨)ના લગ્ન અને તને પણ જીંદગી યાદ કરાવીશ કહીને ત્રાસ આપતો હતો. આથી રાતાલાં કરા ત્રિવેટડામાં અર્થ પેરેડાઈઢ ઇંગ્લોઝ ખાતે રહેતા ભાવેશ પી.પટેલ(૪૭) સાથે થયા હતા. શીતલબહેન હાલમાં સેલ્સ ટેક્સ કહાન ત્રાસ આપતા હતા. આવા શીતલબહેન તેમના પિયર જતા રહ્યા હતા. દરમિયાન સાસુનુ અવસાન થતા તેમને કે તેમના માતા પિતાને જાણ વિત્રાગમાં સીનીયર કલાર્ક તરીકે કરી ન હતી. પરંતુ શીતલબહેનને તેમના માતાપિતા સાસરે મુક્રી ગયા હતા. લગ્નજીવનથી તેમને દિકરાનો જન્મ થયો હતો. બાદમાં સાસરીયા નોકરી છોડી આશ્મરોડની ઈફ્ર્મટેક્સ આશ્રમરોડની

આશ્મરાડના ઇફ્રમટક્સ આશ્રમરાડના ઓફિસમાં નોકરી કરે છે.એએમટીએસમાં નોકરી જતા શીતલબહેનને કોઈ કારણસર મોડુ થાય તો પતિ તેમની પર શંકા કરીને થાય તો પીત તેમની પર શંકા કરીને ગાળો બોલતો હતો. સાસુની મરણવિયી બાદ પતિએ મકાન માટે ૨૫ લાખ ખુટે છે તારા બાપા પાસેથી લઈ આવ કહીને પરેશાન કરતો હતો. શીતલબેહેને ઈકાર કરતા પતિએ તેમને મારજૂડ કરી હતી. નણંદ અને તમને મારુડ્રુંડ કરો હતો. નેજી દે અને દિયર પણ ભાવેશને ચઢમણી કરતા રહેતા હતા. આ અંગે તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પતિ ભાવેશ, સસરા પુરૂષોત્તમ એમ. લેઉઆ, દિયર નૈનેશ. દેરાણી નીલાબહેન તથા કૈલાશીની હતો અને શંકા કરીને ઝઘડા કરતો હતા અને શકા કરાન ઝલડા કરતા રહેતો હતો. ચાંદખેડામાં રહેતી અને સેલ્સ ટેક્સ વિભાગમાં નોકરી કરતી પરિકૃતિતાને મકાન લેવા માટે પિયરમાંથી ૨૫ લાખ લઈ આવવાનું કહીને મારઝુડ કરતા સાસરીયાઓ સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કરિયાદ નોંધાઈ છે. પટેલ સામે ગુનો નોધાવ્યો હતો. તે સિવાય પતિ વકીલ હોવાથી માટ

વાઇબ્રન્ટ બિઝકોમ લિ. ડિજિટલ ઇન્ડિયા, વોકલ ફોર લોકલ દારા કરશે આત્મનિર્ભર ભારતનું નિર્માણ



અમદાવાદ, વાઇબ્રન્ટ બિઝકોમ લિમિટેડ (ISO 2015: 9001) એક પબ્લિક લિમિટેડ કંપની છે જેનું ૨૬ જૂન ૨૦૧૯ ના રોજ સંસ્થાપન થયેલ છે. વાઇબ્રન્ટ બિઝકોમ લિમિટેડ કલુચરિસ્ટિક, રિયલ એસ્ટેટ, ઇલેક્ટ્રોનિક્સ, હોમકેર અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ અને આયુર્વેદ પ્રોડક્ટ્સ જેવી વિવિધ શ્રેષ્ટ્રીઓનો વ્યવસાય કરે છે. આજે કંપનીના સહસ્થાપકો રું છે. બોર્ક રૂપાણા તેલ સ્વાર્યો અને ડાયરેક્ટર્સ એ તેની વ્યૂહરચના અને ભવિષ્યની યોજનાઓની જાહેરાત કરી. વાઇબરન્ટ બિઝક્રોમ લિમિટેડના

કો -કાઉન્ડર અને ડિરેક્ટર શ્રી પંકિન પરીખે જજાાવ્યું કે, "વાઇશ્વન્ટ બિઝકોમ લિમિટેડની અમારી અનો ખી પહેલની જાહેરાત કરતા અમને ગર્વછે. અમારું મુખ્ય ક્રોક્સ ૩ મુખ્ય મુદ્દાઓ પર છે -ડિજિટઇન્ડિયા મુહિમ, વોકલ ફોર લોકલ એટલે કે આપળા પોતાના ભારતીય અને સ્વદેશી ઉત્પાદકો વેપારીઓને પ્રોત્સાહન આપવા અને ત્રીજું છે "મેં ભી આત્મનિર્ભર" અભિયાન." ડિજિટલ ઇન્ડિયા અભિયાનના ભાગરૂપે, વાઇબ્રન્ટ બિકોમ લિમિટેડએ તેનું ડિજિટલ કેટલોગ લોન્ચ કર્યું છે જે ઇલેક્ટ્રોનિક્સથી લઈને વિવિધ શ્રેણીના હોમકેર ઉત્પાદનો તથા પ્રસંતલ કેર ઉત્પાદનો પર વિગતવાર માહિતી આપી અને એના વેચાણ માટેનું એક ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ છે. વોકલ ફોર લોકલ ઝુંબેશમાં, વાઇબ્રન્ટ બિઝકોમ લિમિટેડ સ્થાનિક ઉત્પાદકો અને વેપારીઓને વિશિષ્ટ ડિજિટલ મકામ બનાવે છે. (૧૯-૮)

અમદાવાદ, આ ટ્રેલરનું લોકાર્પણ ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રના પર્યાવરણ

અને પર્યટન અને પ્રોટોકોલના માનનીય મંત્રી શ્રી આદિત્ય ઠાકરેની

માનનાય મત્રા શ્રા આદાવ ઠાકરમાં હાજરીમાં આપણાં ક્રન્ટલાઇન કામદારો અને નાયકોને શ્ર્ધાંજલિ આપવા માટે કરવામાં આવ્યું હતું.

निजिल अरवाली द्वारा अनाववाभ

નિર્મિલ અડવાલી દ્વારા બનાવવામાં આવેલું અને એમ્માય એન્ટરટેઇનમેન્ટ હારા નિર્મિત, મુંભઈ ડાયરીઝ ર / ૧૧ એ ર ક/૧૧ અતકવાલી દુ. પ્રવાસ પુરાના માને એન્ટર કરવામાં આવેલું એકલ્પનિક નાટક છે તે કન્ટલાઇન પોદ્ધાઓને શ્રદ્ધાં જાલે આપે છે. કેક્સા તેન શર્મા, મોહિત રૈના, ટીમા દેશાઈ, શ્રેષા ધનવતી,

એમેઝોન પ્રાઇમ વીડિયોએ ફ્રન્ટલાઇન કામદારોને શ્રદ્ધાંજલિ

આપવા મુંબઈ ડાયરીઝ ૨૬/૧૧નું ટ્રેલર લોન્ચ કર્યુ

કેસો ઘટતા રાજકોટમાં હોટલો ફુલ : સવારથી ટ્રાફિકજામના દેશ્યો

રાજકોટ, હવે કેસ ઘટતા અને છ્ટાબાટ મળતા રક્ષાબંધનના તહેવાર ખૂટ્યાટ મળતા રક્ષાંબંધનના તહેલાર અને રવિવારના સંયોગ સાથે શહેરીજનોની સવારથી જ મુખ્યમાર્ગો પર ભીડ જોવા મળી હતી. સાથે શહેરની મખ્ય બજારોમાં પણ હવે સહરના મુખ્ય બજારાના પક્ષ હવ સાતમ-આઠમની ખરીદીની પણ રંગત જામી છે. રવિવારે શહેરના મુખ્યમાર્ગો ઉપરટ્રાફિકના દરયો જેવા મળ્યા હતા. કપડાંની બજાર, ઇલેક્ટ્રોનિક્સ બજાર, વાહનોના શો-રૂમમાં પણ નવા વાહન પણ્ન મોટી સંખ્યામાં ખરીદાયા હતા. કર્ફયૂ પણ

રાત્રીના ૧૧ વાગ્યા સુષીનો હોવાશી સુષી એટલે કે ૫૨૦ દિવસની ખાણીપીભીની બજાર અને શહેરમાં તહેવારબંધી બાદ રવિવારે અને રાજકોદની ભાગોળે હોટેલ- રાજકોદવાસીઓએ પ્રથમ વખત કેટ્સેટર-સ્થો પહુનો શો સંખ્યાબંના પર્ય મન ભરીને માણ્યો ઉમત્ર્યા હતા. રાજકોટને રંગીલું શહેર હોય એવો માહોલ શહેરમાં જોવા મળ્યો કહેવામાં આવે છે. રાજકોટિયન્સ માટે ઝહેવાના આવે છે. સજકાદન્સ નાટ એવું કહેવાય છે કે તેઓ જિંદગીને મન ભરીને માણે છે. રંગીલો મિજાજ, ખાશીપીલીનો શોખ અને જલસાથી જીવતા માણસો છે રાજકોટવાસીઓ. ગુજરાતનો સૌથી પહેલો કોરોનાનો યુજરાતના સાધા પહેલા કારોનાના કેસ રાજકોટમાં ૧૯ માર્ચ, ૨૦૨૦ના રોજ નોંધાયો હતો ત્યારથી લઈને આજ

ડી બીઅર્સ ફોરેવરમાર્કે એના ૧૦માં વાર્ષિક ઇન્ડિયા ફોરમનું આયોજન કર્યું



અમદાવાદ, ડી બીઅર્સ કોરેવરમાર્કે ર૪થી ૨૬ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી મુંબઈમાં એનું ૧૦માં વાર્ષિક ઇન્ડિયા કોરમનું આયોજન કર્યું છે. વર્ચ્યુઅલ અને પર્સનલ એમ હાઈશ્રિડ ઇવેન્ટમાં આયોજિત આ હાઇભ્રહ ઇવન્ટમાં આપાજત આ કોટમમાં ડાયમન્ડ શ્રાન્ડ ૮ ક્રીકેષ્ઠ પાર્ટન, હીરાના વેપારીઓ, ઉત્પાદકો અને ગ્રાહ્કો સુધી પહોંચી હતી. ચાલુ વર્ષની થીમ 'મેક લાઇક બ્રિલિયન્ટ' ડી બીઅર્સના ઉદેશને પ્રતિબિબિત કરતી હતી. વળી બ્રાન્ડ એની બિલ્ડિંગ કોરેવરની કટિબઢતા તથા એના साहसिङ अनमहत्वाङांबी २०३० સસ્ટેઇનેબિલિટી લક્ષ્યાંકો સાથે સસ્ટઇનાનાલટા લખ્યાકા લાખ જ્વેલરીની સદ્યબહાર ડિઝાઇનો માટે એના ડાયમન્ડ એના ગ્રાહકો, સમુદાયો અને પૃથ્વી માટે મેક લાઇક

અભિનીત આ શો ૯ સપ્ટેમ્બર

૨૦૨૧ના રોજ ૨૪૦થી વધુ દેશો અને પ્રદેશોમાં રિલીઝ થશે

એમેઝોન પ્રાઈમ ઓકર કરે છે નવીનતમ અને વિશિષ્ટ મુવીઝ, દીવી

હાલમાં એસ્ટેલ પ્રીપેડ

આહકો માટે ઉપલબ્ધ છે. (૧૯-૮)

માન્યતા સાથે જોડવા પર કન્દ્રિત છે. જ્યાં કંપનીને ડીગ મળે છે -

જ સ્વાસ કરાદા કારા કરા સ્વાસ્ત્ર પરોલે કહ્યું, સરકાર ક્રારા ભૂતકાળમાં સમાજના વડીહાને સાથે રાખી ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મૃતક પારીદાર પરિવારોને સરકારી અને અર્થક્રદકરા ભૂલી ગઈ છે. પારીદાર સમાજના યુવકો આપવાનું વચન સરકાર ભૂલી ગઈ છે. પારીદાર સમાજના યુવકો સ્ક્રદાં સર્થ પારીકાર સમાજના યુવકો સ્ક્રદાં સર્થ કર્યા અને તે મારે પારીદાર સમાજની સંસ્થાઓ ખોડલામ કાગવડ અને સંસ્થાઓ ખોડલામ કાગવડ અને સંસ્થાઓ ખોડલામ કાગવડ અને વિજ્ઞદ મિત્યાવામાના ટ્રસ્ટીઓને મળીને તે મનો સહયોગ પણ લેવાશે. પારીદાર સમાજના અન્ય

કિન્ટેક રીન્યુએબલ્સ લિમિટેડ કોર્પોરેટ ઓળપ સંખ્યા: ૧૪૦૧૦૫૯૩૧૯૮૫મ.C૦૧૩૨૫૪ રજિસ્ટ્રી ઓક્સ ક્લિક તાલ, ૮, લિવાલિક પાલ, એ. એમ. એ. ની. સાથે, આઇ. આઇ. એમ. એક. અસાકાર્ટ ન્ટરંગ્ડ૧૫, ગુજરાત દેશિ: (૦૦૯) ૨૬ ૩૦૩૦૬૧, વેબસાઇટ: www.kintechrenewables.com, ઈમેલ: coolidatechrenewables.com ૩૬મી વાર્ષિક સામાન્ય સભા કે જે વીડિઓ સંગઠન ("વીસી") અથવા અન્ય ઓડિયો વિઝ્યુઅલ મીન્સ("ઓવીએમ") કારા યોજવા એગેની નોટિસ

્યામાં આવે છે કે કિન્ડેક રીન્યુએલલા લિમિટેક (કંપની) ના સભ્યોની કન્મી લાઉલ સામાન્ય સભા (AGM) ૨૮મી સપ્ટેમ્લર વાર ના શેજ સવારે ૧ ૧.૦૦૦થાંગે વીડિયોનો સંગઠન ("વીકી") અથવા અન્ય ઓડિયો રિઝ્યુબલ મીન્સ ("ઓવીએમ") હા . કે જેમાં વાર્ષિક સામન્ય સભા ની જાલ કરતી નોટિસ તારીખ ૧૪ એગસ્ટ, ૨૦૨૧ માં જણાવેલ કામક્રાન્ને અંતર્ગત રાખવાય

ક્ષાવડ-૧૯ ક્ષ્મલાયા રાગચાલાન ચાનના રાખાન, ભારત સરક્ષક, ક્ષ્માયરભાગતાના મગલલ વના પારવર ને . ૧૪/૦૨૦ કહ્ય, ૨૦૨૦, પરિયત્ર ને . ૧૭/૨૦૨૦ના તા. ૧૩ એપ્રિલ, ૨૦૨૦, પરિયત્ર ને૨૦/ ૨૦૨૦ના તા. ૦૫ મે ૨૦૨૦, સામા ૦૨/૨૦૨૧ના તા. ૧૩ જ્ઞન્યુઆરી, ૨૦૨૧ અને સંબેના પરિયત્ર તા. ૧૨ મે, ૨૦૨૦, તા. ૧૫ જ્રન્યુઆરી, ૨૦૨ ! માં AGM કોઈપલ. સભ્યોની. ભીતિક હાજરી વગર વીડિઓ સંગઠન ("વીસી") અથવા ખન્ય ઓડિયો રિઝ્યુઅ

હર્ષલ ગાંધી કંપનીના સચિવ

ગુજરાત નેચરલ રીસોર્સીસ લીમીટેડ

સીના: L27100G11991PtC016158 રજીસ્ટર ઓક્રીસ : ઉલ્લે માત્ર એ વિગ, ગોપાલ ઘેલેસ, ઓસીએન પાર્ક સામે, નાહેનનાર પાર્ચે, સેરેક્ષાઈર કોડ, અથધાવાદ-૩૮૦૦૧પ કોનનો : Ose-જ00૨૯૮૦૬ ઈમેઇલ: info@gnfl.in વેભસાઈટ: www.gnfl.in

નોટીસ

નાટાસ ઈ-વેસ્ટર એજ્યુકેશન અને પ્રોટેક્શન કંડ (આઈઈપીએક) ડિમેટ એકાઉન્ટમ કંપનીના ઇક્વિટી શેર્સ અને દાવો નહી કરાયેલું ડીવીડન્ડ ટ્રાંસકર કરવા માટે

ર્કપનીના ઇક્સિટી શેસે અને દાવો નહી કરાયેલું હીવી કરે ટ્રાંસસ્ટ કરવા માટે આથી અહીં તરીક આપવામાં આવે છે. કંપની એક 20 ગઢ ની અવાડા અનુષ્કે ૧ રૂપ દેખી એક 20 ગઢ ની અવાડા અનુષ્કે ૧ રૂપ દેખી એક 20 ગઢ ની અવાડા અનુષ્કે ૧ રૂપ દેખી એક 20 ગઢ ઓપરેડીટી (હીસાબી, ઓડીટ, ટ્રાન્સક્ટ અને રીકંગ) નિયમ 20 ૧૯ અને (હિસાબી, ઓડીટ, એક્સ્પ્રેસ અને રીકંગ) નિયમ 20 ૧૯ અને (હિસાબી, ઓડીટ, એક્સ્પ્રેસ નિયા સેટ આબારે અને પ્રતિક્ર કર્યા માટે કર્યા નિયમ કર્યા માટે કર્યા ના સ્ટેસ ની તરાય સેટ આબારે હીવાના અને કર્યા માટે કર્યા ના સ્ટેસ ની સાર્ટ કર્યા માટે કર્યા મા

જા દેવન પ્રવાસ સાવન સાત પર્યું હોય સરકાલ્ટર વારસ્વાદ હોય છે. તેમના શેર કે દેવાને ન કર્યો હોય આ નાંક્ષાકીય વર્ષ ૨૦૧૩ન ૧૪થી શરૂ થાય છે. તેમના શેર કે આઈઇપીએફને તબદીલ થવાને પાત્ર છે તે શેર હોલ્ડરર્સને એમના શેર્સ નો દાવો કરવા વિનંતી તે શેર હોલ્ડરોની માહીતી કંપનીની વેભસાઇટ www.gnrl.in પર

હલ્લખ છું. 'પેબાએ આવા કોરડોહંદરો કે જેમલે નાલાંદીય વર્ષ ૨૦૧૭ન ૧૪થી સાર્વ ગ અનારા સુધી ડીવીડન્ડ ન લીધુ હોય તે પન માહીતી આપી છું. દોરહોહ્દરોને જે પત્ર મોકલવામાં આવશે છે. તે દોષ અતારા સુધી ડીવીડન્ડ ન લીધુ હોય તે પન માહીતી આપી છું. દોરહોહ્દરોને જે પત્ર મોકલવામાં આવશે છે. ધારે કુલીડ્યાં લોદ પાટે અલ્લક કરવાની પિતની કરવામાં આપે છે. ધારે કહ્યાં કરો હોસ્ટા તે હાર્વ કર્યું કહ્યાં કરો હોસ્ટા તે હાર્વ કર્યું કહ્યાં કરો હોસ્ટા તે હાર્વ કર્યું કહ્યાં કરો હોસ્ટા તરકથી લાં પ્રધાન માન્ય માને હોસ્ટ તરકથી લાં કરા પાર્યા ન લેખ ૧૮૧૧ સુધીમાં કંપની કે નાથોપારે દુ.અલ્લે એક અભ્યોન સે કોસ્ટાલ્ય કરો હોસ્ટ તરકથી લોકે સુધના ન હતી મળે તો કંપની નિયમોની સુધનાનો વાળવી સુધને સે કોસ્ટાલરોને કરી લાં ક્ષા લાભો આઇપીડોને કરો સ્વાદ કરી કરો અર્જી હોસ કરી હોસ કરી કરો અર્જી હોસ કરી હોસ ક જ્રણ કર્યા વગર આ શેર અને તેને લગતા લાભો આઇઇપીએકને તબદીલ કરી દેશે તને કંપનીએ જે શેર ટ્રાન્સકર કરે છે તેના માટે કંપનીની કોઇ જવાબદારી રહેશે નહી નિયમ પ્રમાણે શેર હોલ્ડરો જે શેર આઇઇપીએક ઓથોરીટીને તબદીલ થઇ ગયા છે તે શેર તથા ડીવીડન્ડ માટે આઇઇપીએફ -પના કોર્મમાં અરજી કરીને દાવો કરી શો કે.આ કોર્મ આઇઇપીએક ઓથોરીટીની વેબસાઈટ www.iepf.gov.in પરચં

ા નિયમ કે પછી આ વિષયની બાબતમાં શેરહોલ્ડરોને કોઇ પ્રશ્ન હોય જ્યા રાત્રાના કાર્ય માના વારાવાના વાતાવાના વાતાવાના કારા કોઈ મોંચ તો તેઓ પ્રત્યોના વિજ્ઞાસ એ દ્વાસ્ત્ર એ જેન્દ્ર ફ્રેપી કેશ્ક્રસ્થી (ઇનિયા) પ્રાપ્યેલે દર્શી મોંડે (ફ્રું દીપાલી યુવી) યુનિટ નં. ૯ શિવ સક્તિ ઇન્ડ એસ્ટેટ , આર. બોરીચા માર્ચ, ક્રસ્તુરમા હોસ્પીટલ લાઇનની સાને, લોએર પેલા (ઇ) યુનાઇ ૪૦૦૦૧૧ કેટલી નં વસ્ત્ર ર ૩૦૧ ૮ ૨૬૧ ઇનેલ support@purvashare.com પ્ર સંપર્ક કરી શકે છે.

ગજરાત નેચરલ રીઓસીંગ લીમીટેલ

શ્રીરામ હાઉસિંગ ફાયાનાન્સ લીમીટેડ SHRIRAM

નેસએચએકએલ)ના અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇઝેશન અને રિકન્સ્ટ્રક્શન અ નાન્સિયલ એસેટસ અને એન્ક્રોરમિન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ (જણાવે ્ર (જણાવેલ નિયમો)ના નિયમ ૩ સાથે વંચાતી કલમ૧૩(૧૨) હેઠા

ક્લકારું (૧૫૧૧), ૧૯૦૦ (૧૪)ના ક્લારના ભવના કાલ્યાં ૧ હતા. હતાં કહ્યાં કહ્યાં ૧ હતા. ભાવેલી સાત્રામાં કુંદ્રને ક્લારે ક્લારના ક્લારના ક્લારના કાલ્યા કોલ્યા કાલ્યા કોલ્યાં કોલ્યા કોલ્યા ૨૩૧૫ ૧૮૧ શુક્રવામાં માંગલા નોહીલો જરી કાર્યા કાર્યા કહ્યાં કે પ્લાવસ્થિત કરજદારો અને જો કોર્યા કાર્યા કોલ્યા ક ૧૮૧૧માં કોલ્યા કેલ્યા કાર્યા કાર્યા કેલ્યા કે કેલ્યાની મોંચ સહી કરનાર અધિકૃત અધિકારીએ જણાવેલ જનાતાને નોઢીસ આપવામાં આવે છે કે અહીં નોચે સહી કરનાર અધિકૃત અધિકારીએ જણાવેલ કાયદાની પૈસા કહ્યુ પ પાર્ટી પુને નિર્દેશ કહ્યું મેં ટ્યુંબળ પ્રેક્ષભેટ (200 વર્ષો ક્રીજ કાર્યવાદી દર્શી પીની વર્ષિત કરવામાં આવેલ તેનાતિની નામ રહેલ મિહનનો સંક્રિકિક કર્જા મેળવી લીધો છે. કલ્લાફ અને માન કે પ્રદેશ કરવામાં અંગલે છે. અને મિહાકન સાથે નો કોઈપણ સોદી ક્રી રાખ કાર્યક્રિયા કાર્યક્રમાં આવેલા છે.

રકમ તેમજ તેના પર વ્યાજના ચાર્જને આધિન રહેશે. કરજદારો ધ્યાન આપે કે આ કાયદાની કલમ ૧૩ ની પેટા કલમ (૮) મુજબ આ ગીરો મિલક

કરજદારી તું નામ અને સરનામું	આગમાં નોટિશ	િવસે ખુતેલ બિલકતનું વર્ણન
દીપક વિશ્યંકભાઈ પટેલ સરોજાંમને દીપક પટેલ સરનાયું: પહોંટ તે, ૧૧૮૬, મનગર સોસાપટી, અંબક્ક સિપ્સિટી પાસે, કિન્દોલી, સરુંન પાસે, કિન્દોલી, સ્વચ્યાસ દીક, ડિન્દોલી, સરુંન પાસે, કિન્દોલી, સર્વાસા દીક, ડિન્દોલી, સ્વચ્યાસ દીક, ડિન્દોલી,	ટ્રેડ - ટ્રેડ	તમામ ભાગ અને હિસ્સો લેન અને બિલિંગ જે પ્લોટને ૧૧૮૦ ન લાગાગ મામ પ્રત્ય પ્રત્ય કરેન મીટલું અ લેન બલોક ને ૧૪૦ જેનો રેલેન્દ્ર સર્ચે ને ૯૨, પૈપી રકીમ ને. ૯૯ (દિન્હોલી ગોડાદા) એફપી ને ૧૧૮૦ એક સામ-દિલ્હોલ, ન્યોપાસી દિલ્હીકર : સુરત માં ફિલ્મ લે મહતકની સારે બાજુરી બાઇ-ફિં પૂર્વે : સીઓપી પશ્ચિમ : સોસાયારી રોડ દલિક: - પ્લોટને ૧૧૮૦ દલિકો: પ્લોટને ૧૧૮૦

નવીનામ અને વિશિષ્ટ ખૂરીઝ, ટીવ શો, સ્ટેન્ડ-અપ કોમેડી, એમેઝોન ઓરિજિનલ્સ, એમેઝોન પ્રાઈમ ખુઝિક ક્ષારા સાંભળવામાં આતું એક-કી ખુઝિક, ભારતના સૌથી મોટા પ્રોડક્ટ્સ સિકેસન પર મકત કાસ્ટ ડિલિવરી, ટોપ ડિલ્સ માટે અલીં એક્સેસ, પ્રાઈખ ગેમિંગ સાથે પ્રાઈમ ચીડિંગ અને મોલાઈલ ગેમિંગ ક્લેન્ટ

રીડિંગ અને મોબાઇલ ગેમિંગ કન્ટેન્ટ સાથે અમર્યાદિત વાંચન સાથે સાચ અનેપાદન પાયમ સાચ અવિશ્સનીય મૂલ્ય પ્રદાન કરે છે, જે તમામ વાર્ષિક ૯૯૯ રૂપિયાના સભ્યપદ દ્વારા ઉપલબ્ધ છે. શ્રાહકો પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશનમાં ાઇન પાડિયા માળાઇલ આડરાવન બસ્ક્રાઇબ કરીને ઈંગ્ઠેંઢી પણ જોઈ શકે . પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન એ સિંગલ-યઝર, મોાઇલ-ઓનલી

તારીખ : ૨૭ ઓગસ્ટ, ૨૦૨૧



PURVA SHAREGISTRY (I) PVT.LTD.

(SEBI Regn. INR000001112 Category 1 Registrars to IPO & Share Transfer Agents)

Serial No.:

Folio / DPID Client ID:

Date:

Pin-0

Dear Sir/Madam,

Unit: GUJARAT NATURAL RESOURCES LIMITED (CIN: L27100GJ1991PLC016158)

Sub.: Transfer of Equity Shares in case of unclaimed dividend in previous seven consecutive years of the Company to Investor Education

and Protection Fund (IEPF)

Re.: Folio No./DP ID and Client ID:

This has reference to the captioned subject;

- a) Ministry of Corporate Affairs (MCA) has notified new Rules viz. "Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016" which have come into force from 7th September, 2016, and subsequently amended by Notification dated 28th February 2017 ('the Rules). The said Rules, inter alia, contain provisions for transfer of all shares to IEPF in respect of which dividend has remain unpaid or unclaimed by the shareholders for seven consecutive years or more.
- b) As per the applicable provisions of the Companies Act, 2013 (the Act), all unpaid dividends are required to be transferred by the Company to the IEPF established by the Central Government, after completion of seven years from the date they became due.
- C) We would like to draw your attention on the captioned subject. Kindly note that according to the records available as on 31/07/2021, you have not encashed the dividend warrants for the following year;

d)

T	Dividend for the year	Warrant /DD No.	Amount (Rs.)	No. of Shares
	2013-2014			
	2014-2015			
Γ	2016-2017			

- e) Please note that as per Section 125 of the Companies Act, 2013, the company will be obliged to transfer any money lying in the unpaid dividend account, which remains unpaid or unclaimed for a period of seven years, to credit the Investor Education and Protection Fund (IEPF). Further, please note that the dividend paid for the financial year 2013-2014 is due for transfer to the IEPF is 30th November 2021.
- f) It may please be noted that if no claim is received by the company or the Share Transfer Agent before 15/11/2021, Company will transfer the shares held by you to Investor Education and Protection Fund pursuant to IEPF Rules, 2016 by following the due process as under:
 - 1. **In case of shares held in physical form –** by issuance of duplicate share certificate and transfer the same to IEPF. The original share certificate(s) which stand registered in your names and held by you, will stand automatically cancelled;
 - 2. In case of shares held in demat mode Your demat account will be debited for the shares liable for transfer to the IEPF.
- g) Please note that no claim shall lie against the company in respect of the unclaimed dividend and share transferred to the IEPF. However, both the unclaimed dividend amount and the shares can be claimed from the IEPF Authority by making an application in the prescribed Form IEPF-5 online and sending the physical copy of the same duly signed (as per the specimen signature recorded with the Company) along with requisite documents enumerated in the Form IEPF-5 to the Company.
- h) The Rules and the application form (Form IEPF-5), as prescribed by the MCA for claiming back the shares/ dividend, are available on the website of the MCA (www.iepf.gov.in.).
- i) For applying duplicate warrants of unpaid dividend, please send us the covering letter along with following documents :-
 - Self-attested copy of PAN card of all the Shareholders
 - 2. Bank details of First Shareholder (original cancelled cheque or first page of bank pass book)
 - 3. Aadhar card / Election Card / Electricity Bill of First Shareholder

Please feel free to contact the Company / the Registrar & Transfer Agent (PURVA) in case you have any queries, as per details furnished hereunder:

Ms. Sheetal Pandya

Gujarat Natural Resources Limited

3rd Floor, A Wing, Gopal Palace, Opp. Ocean Park, Nr. Nehru Nagar,

Satellite Road, , Ahmedabad, Gujarat, 380015

Tel No. 079-40029806

Email: sheetal@gnrl.in
Website: www.gnrl.in

Ms. Deepali Dhuri

Purva Sharegistry (India) Private Limited

Unit no. 9 Shiv Shakti Ind. Estt., .R. Borichamarg, Opp. Kasturba Hospital

Lane Lower Parel (E), Mumbai 400 011

Tel No. 022 - 2301 8261

Email: support@purvashare.com
Website: www.purvashare.com

Thanking you,

Yours Faithfully,

For Purva Sharegistry (India) Pvt. Ltd.

Sd/-

Authorised Signatory

9 Shiv Shakti Industrial Estate, J. R. Boricha Marg, Lower Parel East, Mumbai - 400 011
Tel : 2301 2518 / 2301 6761 • Fax : 2301 2517 • Email: support@purvashare.com • Web : www.purvashare.com